

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers, Dalal Street,
Fort, Mumbai – 400 001.
BSE Scrip Code: 522257
BSE Script ID: RAJOO

Sub: Submission of Newspaper Clippings of Extracts of Financial Results for the Quarter and half year ended September 30, 2022 Published in the Newspapers.

Ref: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015 (SEBI Listing Regulations).

Dear Sir/ Madam,

With reference to the Captioned subject and pursuant to Regulation 47(1)(b) and (3) of Listing Regulations, as amended, we are enclosing copy of e-newspaper clippings of extract of the Un-Audited Financial Results of the Company for the quarter and half year ended September 30, 2022 which has been published today i.e. on Monday, November 07, 2022 in the following Newspapers:

1. English Language Edition “**Financial Express**” and “**The Indian Express**”.
2. Gujarati Language Edition “**Navgujarat Samay**” and “**Financial Express**”.

Kindly take the same on your record and acknowledges the receipt.

Thanking you.

Yours faithfully,

For Rajoo Engineers Limited

Khushboo C. Doshi

Managing Director

(DIN: 00025581)

Encl: a/a



Rajoo Engineers Limited

Regd. Office : Rajoo Avenue Survey No. 210, Plot No.1, Industrial Area, Veraval (Shapar) Dist-Rajkot - 360 024. Gujarat - India.

+91-97129-62704/52701/32706

+91-90990 96292

rel@rajoo.com

www.rajoo.com

CIN : L27100GJ1985PLC009212 GSTN : 24AABCR3204M1ZL



TATA CAPITAL FINANCIAL SERVICES LIMITED

Registered Address: 11th Floor, Tower A, Peninsula Business Park, Ganpatra Kadam Marg, Lower Panel, Mumbai - 400013. Branch Office: 902 - 906, Quantum Tower, Chinchooli, Gopindji Shroff Marg, Malad West, Mumbai - 400064

1) Bhavani Stores, Through its Proprietor, Shop No. 1 & 2, Shilalekha Apartment, Gopipura, N.D.K. Char Rasta, Surat - 395001. Also at: Shop No. 302 & 302-A, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370. Also at: Shop No. 303, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370.

2) Pravin Purohit 8/1265, Ranglidas Maheta Street, Gopipura, Nanpura, Surat 395001. Also at: Shop No. 302 & 302-A, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370. Also at: Shop No. 303, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370.

3) Hanuman Sardarji Purohit, 8/1265, Ranglidas Maheta Street, Gopipura, Nanpura, Surat - 395001. Also at: Shop No. 302 & 302-A, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370. Also at: Shop No. 303, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370.

4) Bhavani Pravin Purohit, 8/1265, Ranglidas Maheta Street, Gopipura, Nanpura, Surat - 395001. Also at: Shop No. 302 & 302-A, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370. Also at: Shop No. 303, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370.

5) Sangita Hanuman Purohit, 8/1265, Ranglidas Maheta Street, Gopipura, Nanpura, Surat - 395001. Also at: Shop No. 302 & 302-A, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370. Also at: Shop No. 303, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370.

6) Pravinaben Sardarji Purohit, 8/1265, Ranglidas Maheta Street, Gopipura, Nanpura, Surat - 395001. Also at: Shop No. 302 & 302-A, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370. Also at: Shop No. 303, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370.

7) M/S. Shree Anant Developers, Through its Partner, Shop No. 302 & 302-A, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370. Also at: Shop No. 303, Rahul Raj Mall, Opp. Valentine Cinema, Dumas Road, Surat - 394370.

SUBJECT: NOTICE UNDER RULE 9 (1) AND RULE 8 (8) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 FOR SALE OF IMMOVABLE SECURED ASSET

Dear Sir/Madam,

The Authorized Officer on behalf of M/s Tata Capital Financial Services Limited (hereinafter referred to as "Secured Creditor") has issued the Demand Notice dated 16th August 2019 to you with respect to your Loan Against Property Account No. 767026 and 7671608 under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred to as "the Act"), calling upon you to address to pay the entire dues within the period stipulated, therein. Since the addressee has failed to comply with the said notice within the period stipulated, therefore, the Authorized Officer has taken the Physical Possession of the immovable property under Sub-section (4) of Section 13 of the Act read with Rule 8 of Security Interest (Enforcement) Rules, 2002, on 22nd March 2022.

Schedule of Property: Property 1: All rights, title and interest in Non-Agriculture property bearing Revenue Survey No. 54 (New 20), T.P. Scheme No. 28 (Rundh - Vesu) F.P. No. 31 admeasuring 16320.00 Sq. Mtrs., Paik constructed building known as "Rahul Raj Mall" paik Third Floor Shop No. 302, having admeasuring 53.36 Sq. Mtrs., of Carpet area and 98.79 Sq. Mtrs., of super built - up area of Rundh at Taluka Surat City, Dist. Surat. Bounded by as under; North: Shop No. 301, South: Shop No. 303, East: Road, West: Passage

Property 2: All rights, title and interest in Non-Agriculture property bearing Revenue Survey No. 54 (New 20), T.P. Scheme No. 28 (Rundh - Vesu) F.P. No. 31 admeasuring 16320.00 Sq. Mtrs., Paik constructed building known as "Rahul Raj Mall" paik Third Floor Shop No. 302A, having admeasuring 56.39 Sq. Mtrs., of Carpet area and 102.56 Sq. Mtrs., of super built - up area of Rundh at Taluka Surat City, Dist. Surat. Bounded by as under; North: Shop No. 301, South: Shop No. 303, East: Road, West: Passage

The Secured Creditor through its Authorized Officer has issued public auction notices Four times for sale of the above-mentioned mortgaged property. The first Public Auction Notice was issued, it was communicated to you that in case the entire amount as demanded in the Notice under section 13(2) is not discharged by you, the Secured Creditor would sell the mortgaged property by a public e-auction to be conducted on 25th June 2020. The Secured Creditor did not receive any bids in respect of the first auction. The Secured Creditor then issued second auction sale notice. It was communicated to you that in case the entire amount as demanded in the Notice under section 13(2) is not discharged by you, the Secured Creditor would sell the mortgaged property by a public e-auction to be conducted on 25th August 2020. The Secured Creditor did not receive any bids in respect of the second auction.

The Secured Creditor then issued Third auction sale notice. It was communicated to you that in case the entire amount as demanded in the Notice under section 13(2) is not discharged by you, the Secured Creditor would sell the mortgaged property by a public e-auction to be conducted on 9th December 2020. The Secured Creditor did not receive any bids in respect of the Third auction. The Secured Creditor then issued Fourth auction sale notice. It was communicated to you that in case the entire amount as demanded in the Notice under section 13(2) is not discharged by you, the Secured Creditor would sell the mortgaged property by a public e-auction to be conducted on 5th July 2022. The Secured Creditor did not receive any bids in respect of the Fourth auction as well.

Now, the Secured Creditor has received an offer from a Proposed Purchaser for purchasing the one of the secured assets as described in Schedule with respect to loan account no. 7671608 for Rs. 40,00,000/- (Rupees Forty Lakh Only) by way of private treaty and in line with provision of rule 8 sub-rule 8 of Security Interest (Enforcement) Rules, 2002.

In light of the above said circumstances the present notice is issued to you under Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002, whereby the secured creditor is once again calling upon you to remit a sum of Rs. 80,82,233/- (Rupees Eighty Lakh Eighty Two Thousand Two Hundred Thirty Three Only) as on 16th August 2019 with respect to loan account no. 7671608 along with applicable future interest and charges within 15 days of the date of the present notice, failing which the Authorized Officer will be at liberty to proceed for sale of the mortgaged property by way of a private treaty as mentioned above.

DATED: 07/11/2022 Sd/- Authorized Officer
PLACE: Rundh, Surat. Tata Capital Financial Services Limited

TORRENT PHARMACEUTICALS LIMITED

Registered Office: Torrent House, Off Ashram Road, Ahmedabad - 380 019 Gujarat, India
Ph: +91 79 26599000
Fax: +91 79 26582100

PUBLIC NOTICE

Notice is hereby given that the original share certificates, details of which are given hereunder, have been reported lost / misplaced:

Sr No	Folio No.	Name Of the Share Holders	No of Shares	Certificate Nos	Distinctive Nos (From)	Distinctive Nos (To)
1	TRE096704	Ghanashyam Talwar Sunesta Talwar	200	3285	534847	535046
			200	6659	42840527	42840726
			400	7308	84721661	84722060

Pursuant to request received from concerned shareholder, the Company intends to issue duplicate share certificates in lieu of the aforesaid original share certificates. Public is cautioned against purchasing or otherwise dealing with the above mentioned share certificates. Duplicate share certificates thereof will be issued to the above named shareholder, unless any objection is received by the undersigned within 10 days from the date of publication of this notice.

For TORRENT PHARMACEUTICALS LIMITED
Place : Ahmedabad CHINTAN M TRIVEDI
Date : 05th November, 2022 COMPANY SECRETARY

POSSESSION NOTICE DCB BANK

The undersigned being the authorized officer of the DCB Bank Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Ordinance, 2002 (Ord. 3 of 2002) and in exercise of powers conferred under section 13(2) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice as mentioned in below table calling within named borrowers, co-borrowers to repay the amount mentioned in the notice being an amount as detailed mentioned in table given hereunder within 60 days from the date of receipt of the said notice.

The borrower and Co-Borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, Co-Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Ordinance read with Rule 9 of the said Rules on this 02nd day of November of the year 2022.

The borrower, Co-Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the DCB Bank Limited for an amount as mentioned in the demand notice and further interest thereon.

Sr. No.	Loan Account	Borrower / Co-Borrower	Date of Demand Notice
1	HHOMSUR00037026, DRBLSUR00509795	1. Dinesh Narayan Gangwani 2. Santosh Dinesh Gangwani	18.05.2022
Total Outstanding In: Rs. 40,01,424.41/- (Rupees Forty Lakh One Thousand Four Hundred Twenty Four And Paise Forty One Only) as on 18.05.2022.			

Description of The Immovable Property: Property bearing Flat No. 702 on 7th Floor admeasuring 1225 sq.ft i.e. 113.80 sq.mtrs Super Build up area & 68.19 sq.mtrs build up area along with undivided share in the land of "Shivam Apartment" Situated at revenue survey no. 153/1 paik TP scheme no. 27 (Bhatar-Majura) Final Plot no. 73-8 paik sub plot no. 3 admeasuring 1486 sq. mtrs Moje Majura city of Surat.

2	DRMBANK00412108	1. Mohmedanver Hajiriyahzusen Kureshi 2. Sahenzabanu Mohmedanvar	04.05.2019
Total Outstanding In: Rs. 5,17,461.04/- (Rupees Five Lakh Seventeen Thousand Four Hundred Sixty One And Paise Four Only) as on 04.05.2019			

Description of The Immovable Property: Property bearing Flat No. 105 1st Floor, admeasuring build up area 34.18 sq.mtrs "Alitza Apartment", Situated at city Survey No. 2787 to 2789 of Moje Village Ankleshwar Karodiyawad, District Bhachruk

Date: 2/11/2022 For DCB Bank Limited
Place: Surat, Ankleshwar Authorized Officer

AXIS BANK LIMITED

CIN: L28270GJ1972PLC002126
Website: www.axisbank.com
Email Id: investorservices@axisbank.com

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower i.e. Sharnam Aluminium Extrusion Pvt. Ltd. (formerly known as Aarkee Extrusion Pvt. Ltd.) and Guarantor(s)/Mortgagor(s)/Owner(s) i.e. Mr. Prayush Panamchand Shah, Mr. Ashokkumar Pursotamdas Panchal, Mr. Harish Durlobhadas Kagrana and Mrs. Prathna Harishbhai Kagrana that the below described immovable properties mortgaged/charged to Axis Bank Ltd. i.e. Secured Creditor, the physical possession of which has been taken by the Authorized Officer of Axis Bank Ltd. i.e. Secured Creditor will be sold on "As is Where is Basis", "As is What is Basis", "Whatever There is Basis" and "No Recourse Basis" on 16th December 2022, for recovery of Rs.7,47,56,168/- (Rupees Seven Crore Forty Seven Lakh Fifty Six Thousand One Hundred Sixty Eight) as on 30.06.2019 plus further interest from 01.07.2019 at the contractual rate due to Axis Bank Limited i.e. Secured Creditor from the aforesaid Borrower / Guarantor(s) / Mortgagor(s)/Owner(s). The reserve price will be:

DESCRIPTION OF PROPERTY	RESERVE PRICE	EARNEST MONEY DEPOSIT (EMD)	AUCTION ID
Industrial property located at Revenue Survey No.90/3 Block No. 66, with NA Land admeasuring 2023 square metre and construction thereon (admeasuring 927 square metres) at Mouje - Alangir, Dist - Vadodara	Rs.2,13,00,000/- (Rupees Two Crore Thirteen Lakh)	Rs.21,30,00,000/- (Rupees Twenty One Lakh Thirty Thousand)	256662
Plant & Machinery	Rs.40,00,000/- (Rupees Forty Lakh)	Rs.4,00,00,000/- (Rupees Four Lakh)	256663

The Borrower/Guarantor(s)/Mortgagor(s) attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

For detailed terms and conditions of the sale, please refer to the link provided in <https://www.axisbank.com/auction-notices> and/or <https://axisbank.auctiontiger.net> (Auction ID is mentioned above).

Date: 07th November 2022 Sd/- Authorized Officer
Place: Vadodara Axis Bank Ltd.



Kotak Mahindra Bank Ltd.

REGISTERED OFFICE: 27, BKC, C-27, G Block, BANDRA KURLA COMPLEX, BANDRA (EAST), MUMBAI - 400051
BRANCH: 8th Floor, International Business Centre, Gaurav Path Road, Dumas Road, Pipload, Surat - 395007

PUBLIC NOTICE FOR E-AUCTION FOR SALE OF MOVABLE/IMMOVABLE PROPERTY
LAST DATE & TIME OF SUBMISSION OF EMD AND DOCUMENTS (HARD COPY) AND (ON LINE) 14.12.2022, 04:00 PM
DATE & TIME OF E-AUCTION: 15.12.2022, 11:30 AM TO 3.00 PM
(with unlimited extensions of 5 minutes duration each till the conclusion of the sale)

PUBLIC NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES MORTGAGED TO THE BANK UNDER SECURITISATION & RECONSTRUCTION OF FINANCIAL ASSETS & ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002 (NO. 54 OF 2002) SARFAESI ACT.

Whereas, the borrower's named hereunder have defaulted to Kotak Mahindra Bank Ltd. and owe the sums as indicated herein below and further interest thereon, Kotak Mahindra Bank Ltd., through its Authorized Officer, had taken possession of the mortgaged properties under section 13(4) of SARFAESI Act 2002 and the Bank has decided to sell the properties, described here in below against their names, on "as is where is" and "as is what is" and "no complaint" condition, under rule 8 to 9 of the Security Interest (Enforcement) Rules, 2002. The sale will be done by the undersigned through e-auction platform provided at the website: <https://kotakbank.auctiontiger.net> also on kotakbank.auctiontiger.net

Name of Account & Borrower/ Mortgagor(s)/ Guarantor(s)	Description of the immovable property	Amount (s) as per demand notice	EMD REMITTANCE Account Details	Reserve Price	Earnest Money Deposit	Bid Increase Amount
1. Mr. Ghanashyambhai M Karad (Borrower cum Mortgagor) Address: A-20 Swaminarayan Div-2, Varachha Road, Near Surat Diamond Girls High School, Surat 395006, Gujarat, India. 2. Mr. Jayshukhbhai Harjibhai Karad (Co-Borrower) Address: 102, Machiyala Nana-2, Ta. Amreli, Gujarat-365601, India. 3. Mr. Jitendrakumar M Karad (Guarantor) Address: A-20 Swaminarayan Div-2, Varachha Road, Near Surat Diamond Girls High School, Surat 395006, Gujarat, India. 4. Mrs. Bhavnaben Ghanashyam Karad (Guarantor and Mortgagor) Address: #5 Machiyala Nana-2, Ta. Amreli, Gujarat-365601, India. 5. Mrs. Jamanaben Manubhai Karad Alias Mrs. Mamtaben Manubhai Karad (Guarantor and Mortgagor) Address: #5 Machiyala Nana-2, Ta. Amreli, Gujarat-365601, India.	Non Agriculture immovable residential property being Plot No. 65, 69 & 70, further interest, (Municipal Asset/Property Number 71A/05-0701-0-001), admeasuring total area of 233.93 Sq. Mts., with construction thereon around 72.58 Sq. Mts., with all other present and future construction on the said land, in the scheme known as "Harikrishna Park Society" of Revenue Survey No. 120/1 & 121, Block No. 114, TPS No. 18, FF No. 62, MahadevChowk, At: Motla Varachha, Ta. Choryasi, Dist. Surat, Gujarat. India owned and possessed by 1. Mr. Ghanashyambhai Manubhai Karad (Plot No. 69) & 3. Mrs. Jamanaben Manubhai Karad Alias Mrs. Mamtaben Manubhai Karad (Plot No. 70) Boundaries PLOT NO.68: East: Road, West: Open Space, North: Plot No. 69, South: Plot No. 68A, PLOT NO.69: East: Road, West: Open Space, North: Plot No. 70, South: Plot No. 69.	Rs. 73,24,870.25 with further interest, cost & charges, thereon	Account No. 06410125272001 Kotak Mahindra Bank Ltd., Nariman Point Branch, Mumbai. IFSC Code: KKBK00009958	Rs. 1,79,36,000/-	Rs. 17,93,600/-	Rs. 50,000/-

Property 1:	Property 2:	Property 3:	Property 4:
Rs. 1,60,00,000/-	Rs. 16,00,000/-	Rs. 50,000/-	Rs. 36,55,000/-
Rs. 44,64,000/-	Rs. 4,46,400/-	Rs. 50,000/-	Rs. 3,65,500/-
Rs. 23,71,000/-	Rs. 2,37,100/-	Rs. 50,000/-	Rs. 3,65,500/-

Property 1: Non-Agriculture immovable commercial property in 7th Floor, Office no. 1, 2, 4, 5, 6, 7 & 8 in building B of "Club 100 Empire" admeasuring total build up area of 605.02 sq. mtrs. with undivided share in land of Block No. 151/A, Revenue Survey No. 11/1 of Khata No. 463, T.P. Scheme No. 46, F.P. No. 59 B/1, Mahavir Sanskar Dham, Village, Jahanpurpura, Taluka - District - Surat, Gujarat. Owned by Mrs. Krishnaa Creations, A Partnership Firm.

Property 2: Non-Agriculture Immovable shop no. 135 and 136 on first floor, having build up area admeasuring about 46.09 SqMtrs and carpet area admeasuring about 41.90 Sq. Mtrs. Total Build up area admeasuring about 92.18 Sq. Mtrs. And carpet area admeasuring about 83.80 Sq. Mtrs together with undivided share underneath land of "Times Trade Centre" Opp. Polaris Shopping Centre, Canal Road, Pune, Situated and constructed on the land bearing Revenue Survey No. 610/1/3, Block no. 706, as per village form no. 71/2, adme. 5564.00 Sq. Mtrs. Draft T.P Scheme no. 17 (Puna), F.P. No. 152 adme. 3895 Sq. Mtrs of village: Puna, Taluka: Puna (Surat City), District: Surat, Gujarat, owned by Krishna Creation, A Partnership Firm.

Property 3: All that piece and parcel of Immovable shop no.305, on third floor, Built-up area admeasuring about 27.29 Sq. Mtrs. Along with undivided share in underneath land of "Rajiv Shopping", Near ParamhansVidhyaBhawan, Construction on as per approved plan, Plot no.56 to 66 Adme. 159, 161/1, 162, 180 paik. Block no. 154, 155, 165 & 172, T.P. Scheme no.22 (Barthana-Valka), Final plot no. 10/A, & 10/B of Village: Sarthana, Taluka: Puna, District: Surat, Gujarat, owned by Krishna Creation, A Partnership Firm.

Property 4: All that piece and parcel of Immovable shop no. 17, on ground floor, Built-up area admeasuring about 27.18 Sq. Mtrs. And carpet area admeasuring about 27.18 Sq. Mtrs. Along with undivided share admeasuring about 15.02 Sq. Mtrs. in underneath land of "Multiplex & Business Centre" Bis Rivant, Laxuria, Opp. Shungli Home, Chhaprabhattha-Variyav Road, Viriyav, Situated on the land bearing revenue survey no. 1219/2, Block No. 1162 Paiki 2, Town Planning scheme no. 37 (Variyav), Final plot no. 49 adme. 2010 Sq. Mtrs. of village: Variyav, Taluka: Surat, City (Puna), District: Surat, Gujarat, owned by Krishna Creation, A Partnership Firm.

TERMS & CONDITIONS: (1) The E-Auction is being held on "AS IS WHERE IS" & "AS IS WHAT IS BASIS" and no Complaint basis. To the best of knowledge and information of the Authorized Officer, there are no encumbrances on the properties. However, the intending bidders should make their own independent enquiries regarding the encumbrances, title of properties put on auction and claims/rights/dues affecting the property, prior to submitting their bid. The Authorized Officer/Secured Creditor shall not be responsible in any way for any third party claims/rights/dues. (2) It shall be the responsibility of the bidders to inspect and satisfy themselves about the asset and specification before submitting the bid. The inspection of properties put on auction will be permitted to interested bidders in consultation with State Recovery Manager - ABG. (3) The intending bidders may visit the Bank's official website - <https://www.kotak.com/en/bank-auctions.html> for auction details and for the terms and conditions of sale. (the user ID and password can be obtained free of cost by registering name with <https://kotakbank.auctiontiger.net>) through their login ID and Password. The EMD 10% OF RESERVE PRICE shall be payable through Demand Draft/online in favour of "Kotak Mahindra Bank Limited" payable at Surat / at par and to be submitted in the concerned bank branch alongwith Fully Filled up & Signed Copy of Annexure I & III attached to the Tender form on or before 4.00 PM on 14.12.2022. Tender form can also be obtained from the concerned bank branch. (4) After Registration by the bidders in the web Portal, the intending purchaser/ bidder is required to get the copies of the following documents uploaded in the web portal before last date of submission of the bid(s) viz: (i) Copy of the Demand Draft. (ii) Proof of identification (KYC) viz. copy of Voter ID Card/ Driving License/ Passport etc., (iii) Copy of proof of address, (iv) Fully Filled up & Signed Copy of Annexure I & III attached to the Tender form, without which the bid is liable to be rejected. (5) The Interested bidders who require assistance in creating login ID and password, uploading data, submitting bid, training on e-bidding process etc., may avail online training on E-Auction from M/s e-procurement Technologies Ltd. (Auction Tiger), Ahmedabad: Contact Person: Mr. Ram Sharma, Mobile No. 9975591888 & 6351896633, Contact No. 079-68136837/68136890/68136844. E-Mail ID: ramprasad@auctiontiger.net, support@auctiontiger.net, / also on Auction tiger Mobile App. and for any property related query may contact details of bank officials are: Commercial Banking, Kotak Mahindra Bank: 8th Floor, International Business Centre, Gaurav Path Road, Dumas Road, Pipload, Surat - 395007. Mr. Mitesh Parmar, Mobile: +91-9374017931, email: mitesh.parmar@kotak.com, within office hours during the working days. (6) Only bidders holding valid User ID/Password and confirmed payment of EMD through Demand Draft/ online shall be eligible for participating in the online auction process. (7) The interested bidders who have submitted their EMD not below the 10% of reserve price through Demand Draft/ online before 4.00 PM on 14.12.2022 shall be eligible for participating in the e-auction. The e-auction of above properties would be conducted exactly on the scheduled date & time as mentioned above by way of inter-seal bidding among the bidders. The bidders shall improve their offer in multiple of amount mentioned under the column "Bid Increase Amount" against the Property. In case bid is placed in the last 5 minutes of the closing time of the e-auction, the closing time will automatically get extended for 5 minutes (subject to unlimited extensions of 5 minutes each). The bidder who submits the highest bid (not below the reserve price) on closure of online auction shall be declared as successful bidder and a communication to that effect will be issued through electronic mode which shall be subject to approval by the Authorized Officer/Secured Creditor. (8) The Earnest Money Deposit (EMD) of the successful bidder shall be retained towards part sale consideration and the EMD of unsuccessful bidders shall be refunded. The Earnest Money Deposit shall not bear any interest. The successful bidder shall have to deposit 25% of the sale price, adjusting the EMD already paid, within 48 hours of the acceptance of bid price by the Authorized Officer and the balance 75% of the sale price on or before 15th day of the sale or within such extended period as agreed upon in writing by and solely at the discretion of the Authorized Officer. In case of default in payment by the successful bidder, the amount already deposited by the Bidder shall be liable to be forfeited and the property shall be put to re-auction and the defaulting bidder shall have no claim/right in respect of property/amount. (9) The prospective qualified bidders may avail online training on e-auction from M/s e-procurement technologies Ltd. prior to the date of e-auction. Neither the Authorized Officer/Bank nor M/s e-procurement technologies Ltd. shall be liable for any network problem and the interested bidders to ensure that they are technically well equipped for participating in the e-auction event. (10) The purchaser shall bear the applicable stamp duties/additional stamp duty/transfer charges, fees etc. and also all the Statutory non statutory dues, taxes, rates, assessments, charges, fees etc. owing to anybody. (11) The Authorized Officer is not bound to accept the highest offer and the Authorized Officer has the absolute right to accept or reject any or all offer(s) or adjourn/postpone/cancel the e-auction without assigning any reason thereof. (12) The bidders are advised to go through the detailed terms and conditions of e-auction available on the website of M/s e-procurement Technologies Ltd. <https://kotakbank.auctiontiger.net>, before submitting their bids and taking part in e-auction. (13) The publication is subject to the force majeure clause. (14) The sale certificate shall be issued after receipt of entire sale consideration and confirmation of sale by secured creditor. The sale certificate shall be issued in the name of the successful bidder. No request for change of name in the sale certificate other than the person who submitted the bid / participated in the e-auction will be entertained. (15) The bid once submitted by the bidder, can not be cancelled/ withdrawn and the bidder shall be bound to buy the property at the final bid price. The failure on the part of bidder to comply with any of the terms and conditions of e-auction, mentioned therein will result in forfeiture of the amount paid by the defaulting bidder. (16) Decision of the Authorized Officer regarding declaration of successful bidder shall be final and binding on all the bidders. The Authorized Officer shall be at liberty to cancel the e-auction process / tender at any time, before declaring the successful bidder, without assigning any reason. The conditional bids may be treated as invalid. Please note that after submission of the bid, no correspondence regarding any change in the bid shall be entertained. The payment of all statutory / non - statutory dues, taxes, rates, assessments, charges, fees etc. owing to anybody shall be the sole responsibility of successful bidder only. In case of any dispute arises as to the validity of the bid (s), amount of bid, EMD once to the eligibility of the bidder, authority of the person representing the bidder, interpretation and the decision of the Authorized Officer shall be final in such an eventuality, the Bank shall in its sole discretion be entitled to call off the sale and put the property to sale once again on any date and at such time as may be decided by the Bank. For any kind of dispute, bidders are required to contact the concerned authorized officer of the concerned bank branch only. (17) Special Instructions, Bidding in the last moment should be avoided in the bidders own interest are neither the Kotak Mahindra Bank Ltd. nor Service provider will be responsible for any lapse/failure (internet failure/power failure), in order to ward-off such contingent situations bidders are requested to make all necessary arrangements / alternatives such as power supply back-up etc., so that they are able to circumvent such situation & are able to participate in the auction successfully. (For detailed terms & conditions please refer to website) <https://kotakbank.auctiontiger.net> (M/s e-procurement Technologies Ltd.)

NOTE:- The borrower/guarantors are hereby notified to pay the sum as mentioned above alongwith valid User ID/Password and confirmed payment of EMD 30 days from the date of publication to get the properties/ies redeemed, failing which the properties/ies will be auctioned /sold and balance dues, if any, will be recovered with interest and cost.

Date: 07.11.2022 Place: Surat Authorized Officer

Rajoo Engineers Limited

Regd. Office: Survey No 210, Plot No 1, Industrial Area, Veraval (Shapar), Dist. Rajkot-360024 Phone: +91-97129-62704 / 52701/ 32706, Email: compliances@rajoo.com, Web: www.rajoo.com
CIN: L27100GJ1986PLC009212

STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2022

(Rs. in Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter Ended (Un-Audited)		Period Ended (Un-Audited)		Year Ended (Audited)	
		30.09.2022	30.06.2022	30.09.2021	30.09.2022	30.09.2021	31.03.2021
1	Total Income	3407.06	1928.18	3737.50	5335.24	7072.70	17498.59
2	Net Profit Before Tax*	310.54	100.29	463.86	410.83	615.65	1989.57
3	Net Profit After Tax*	232.38	75.05	334.71	407.43	440.5	1479.71
4	Total Comprehensive Income for the period (Comprising Profit / Loss for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	232.38	75.05	334.71	407.43	440.5	1517.57
5	Paid up Equity Share Capital (Face Value of Re.1 Each)	615.31	615.31	615.31	615.31	615.31	615.31
6	Reserve (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year)	0.00	0.00	0.00	0.00	0.00	8765.93
7	Earnings per share (before and						

3 GUJARAT

MORBI TRAGEDY

Police seek documents on deal between govt and Oreva Group

SOHINI GHOSH
MORBI, NOVEMBER 6

THE MORBI police has sought documents and official communication about the agreements between the government authorities and the Oreva Group pertaining to Jhulto Pul, the suspension bridge that collapsed leaving 135 dead on October 30. It is learnt that the cops have issued a communication to Rajkot and Morbi collectorates and the Morbi municipality on November 4 seeking details of the agreements.

"For the collectorate offices, we will send a reminder again in case of failure to produce the documents within 24 hours. We plan to issue summons under CrPC 160 to the Morbi municipi-

pality in case they do not present the said documents," said PA Zala, deputy superintendent of Morbi police and the investigating officer in the case.

Meanwhile, on Saturday, the police reportedly sought an in-camera proceeding as it produced the four of the nine accused before a magisterial court. However, the court rejected the request.

A police official familiar with the investigation told The Indian Express that "the open court proceedings from the last remand hearing alerted the accused and the suspects and Oreva (Group) shut down its office and was locked thereafter."

A local crime branch official also added that the FSL report is expected in the next three working days, and after that, "based on

the findings in the report, coupled with findings from the documents seized and the chief officer of Morbi municipality's statement under CrPC section 154, suspects will be probed further."

At the same time, the police have recovered documents related to the work undertaken by the subcontractor fabricating company in 2007 and 2022 for the bridge. "We have recovered documents pertaining to the purchase, the work order and the contract (signed between Oreva and Dev Prakash)."

The Indian Express had earlier reported that Dev Prakash Fabrication, the company engaged by Oreva Group to restore the bridge, did not undertake any "scientific assessment of structural stability". The company is owned by the father-son duo—

contractors Prakashbhai Laljibhai Parmar (63) and Devangbhai Prakashbhai Parmar.

Police said the 2007 renovation of the bridge was subcontracted to the same proprietors although the company at the time was named 'Vishwakarma'. According to police submissions before the magisterial court Saturday, the police have also recovered purchase and payment papers from Oreva.

Zala said a contract worth Rs 29 lakh was signed between Oreva and the Surendranagar-based fabricating sub-contractor Dev Prakash Fabrication. Oreva allocated another Rs 2.11 lakh for painting jobs pertaining to the bridge, while the electric fitting-related work was to be undertaken by the company itself.

Cong says no alliance with AAP, releases chargesheet against BJP

EXPRESS NEWS SERVICE
AHMEDABAD, NOVEMBER 6

THE GUJARAT Congress on Sunday ruled out any coalition with the Aam Aadmi Party (AAP) in the upcoming Assembly polls, while it also released a "chargesheet" against the "misrule" of the BJP government.

Terming the AAP "opponents" of Mahatma Gandhi and Sardar Vallabhbhai Patel, former president of Gujarat Pradesh Congress Committee (GPCC) Bharatsinh Solanki said, "During Udaipur chintan sankalp shivir where I was a part of the politi-

cal affair committee, we decided that Congress will work with like-minded parties. This is my generalised statement, but AAP is a party that talks about its own interest behind people's benefit and cheats."

"There will be no coalition of any type with them... They have removed Gandhiji's photo from government offices in Punjab. They have insulted Gujarat and the country. Instead of Sardar Patel, who brought together the entire country, they will take support from

Khalistanvadi people and divide. There cannot be any place for such a party in Gujarat," he added.

Solanki was addressing mediapersons while releasing the "chargesheet" against the BJP government listing 21 issues including economic mismanagement, increasing debt on the state, unemployment, crony capitalism, mismanagement of Covid-19 pandemic and deteriorating status of women among others.

"The BJP government neither teaches nor provide government

jobs. BJP government has not built a single government school. On the contrary, more than 6,500 schools have been shut down by the BJP government. All the government hospitals and medical colleges in Gujarat were built under the Congress regime. The BJP government has privatized health and education. Out of 31 medical colleges in the state, there are only 10 government colleges of which nine were opened by Congress," Solanki said.

The Congress is aiming to increase the voting percentage this time which will increase Congress vote share for certain, Solanki said.



DECISION
2022
GUJARAT



Narendra Modi
Prime Minister

“ Social Security Schemes of the Government make people financially strong as they help them face life's uncertainties and support families rise above financial difficulties. ”

Because Family Comes First

- ▶ Over **13 Crore** beneficiaries enrolled under **Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana**
- ▶ Over **29 Crore** beneficiaries enrolled under **Pradhan Mantri Suraksha Bima Yojana**

Join today and secure your loved ones at ₹1.25 a day!!

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Life Insurance cover of **₹2 Lakh** at an annual premium of just **₹436**

- Age Group: 18 to 50 years
- Annual Renewal

Pradhan Mantri Suraksha Bima Yojana

Accident Insurance cover of **₹2 Lakh** at an annual premium of just **₹20**

- Age Group: 18 to 70 years
- Annual Renewal

Auto debit of premium from subscriber's Bank/Post Office Account
Direct credit of claim amount to claimant's bank A/c

Contact your nearest Bank Branch/Post Office to enroll today

Claims should preferably be intimated within 30 days of the accident/death





For more information, call 1800 180 1111 (tollfree)
Visit @DFS_India | www.jansuraksha.gov.in







IDEAS TO REDEFINE BANKING

Ace the Account Aggregator Challenges Win Amazing Prizes

Registration commences from

7th November 2022

Criteria:

Age limit: 18 years and above • Team Size: 1 - 4

OPEN FOR ALL

1ST PRIZE

₹3 LAKHS




SCAN TO REGISTER

Visit to know more: <https://bit.ly/bobWorld-Haackathon> | www.bankofbaroda.in | Follow us on 

Rajoo Engineers Limited

Regd. Office: Survey No 210, Plot No 1, Industrial Area, Veraval (Shapar), Dist. Rajkot-360024 Phone: +91-97129-62704 / 52701/ 32706, Email: compliances@rajoo.com, Web: www.rajoo.com CIN: L27100GJ1986PLC009212



EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2022

Sr. No.	Particulars	Quarter Ended (Un-Audited)			Period Ended (Un-Audited)		Year Ended (Audited)
		30.09.2022	30.06.2022	30.09.2021	30.09.2022	30.09.2021	31.03.2021
		(Rs. in Lakhs except EPS)					
1	Total Income	3407.06	1928.18	3737.50	5335.24	7072.70	17498.59
2	Net Profit Before Tax*	310.54	100.29	463.86	410.83	615.65	1989.57
3	Net Profit After Tax*	232.38	75.05	334.71	307.43	440.5	1479.71
4	Total Comprehensive Income for the period [Comprising Profit / Loss for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	232.38	75.05	334.71	307.43	440.5	1517.57
5	Paid up Equity Share Capital (Face Value of Re.1 Each)	615.31	615.31	615.31	615.31	615.31	615.31
6	Reserve (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year)	0.00	0.00	0.00	0.00	0.00	8765.93
7	Earnings per share (before and after extraordinary items) (Face Value of Re.1/Share)						
	(a) Basic	0.38	0.12	0.54	0.50	0.72	2.40
	(b) Diluted	0.38	0.12	0.54	0.50	0.72	2.40

Note : * There was no exceptional / extraordinary item during the quarter and half year ended on September 30, 2022

The above un-audited financial results for the quarter and half year ended on September 30, 2022 have been reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors of the Company in its meeting held on November 05, 2022. The Statutory Auditors of the Company have carried out limited review of the financial results for the quarter and half year ended on September 30, 2022. Their limited review report does not have any qualification/modification.

The above is an extract of the detailed format of quarterly and half yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarterly/half yearly/yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the company's website (www.rajoo.com)

For & on behalf of Board of Directors of
Rajoo Engineers Limited
Sd/-
Khushboo Chandrakant Doshi
(Managing Director)
(DIN: 00025581)

Place: Veraval (Shapar)
Date: 07/11/2022

Performance Highlights

- Revenue from operations for the quarter was Rs. 33.63 crore in Q2 FY23, as against Rs. 18.21 crore in Q1 FY23, a QoQ increase of 84.65%
- EBITDA (excluding Other Income) was at Rs. 3.60 crore in Q2 FY23 as against Rs. 0.82 crore in Q1 FY23, increase of 338.34% QoQ.
- EBITDA Margin was at 10.69% as against 4.50%, QoQ increase of 619 bps
- Profit after Tax was Rs. 2.32 crore in Q2 FY23 compared to Rs. 0.75 crore in Q1 FY23, QoQ increase of 209.64%.
- PAT Margin was at 6.91% as against 4.12%, QoQ increase of 279 bps.
- Basic EPS stood at Rs. 0.38 in Q2 FY23 as compared to Rs. 0.12 in Q1 FY23

About Rajoo

Based in Rajkot, Rajoo Engineers Limited, having made a modest beginning in 1986, has today emerged as an undisputed global player in blown film and sheet extrusion lines. Owing to its focused efforts in blown film, sheet extrusion lines and thermoformers, the Company enjoys a premium market position in this segment. Being a technology driven Company, product innovations, world-class quality, state-of-the-art workmanship, increased energy efficiency and high levels of sophistication and automation have become the hallmark of Rajoo products during all these years, positioning the Company's products on a global platform, competing with the established world leaders. With representations in many countries of the world and customers in over 70 countries, the Company's exports have multiplied after its debut in the international market in 1990. (www.rajoo.com)

ગુનાઇત રેકોર્ડ સાથેના ઉમેદવારો સામે ચૂંટણી પંચનું આકરું વલણ કલંકિત ઉમેદવારોએ વિગતો સોશિયલ મીડિયા પર પણ આપવાની રહેશે

એજન્સી > નવી દિલ્હી

ચૂંટણીમાં ગુનાઇત રેકોર્ડ ધરાવતા ઉમેદવારો સામે ચૂંટણીપંચે આકરા વલણ અપનાવ્યું છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ તેમના આવા કલંકિત ઉમેદવારોની સંપૂર્ણ વિગતો ફેસબુક અને ટ્વીટર સહિતના તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક અખબાર અને એક રાષ્ટ્રીય અખબારમાં પણ આવી સંપૂર્ણ માહિતી પ્રકાશિત કરવી પડશે.



મેળવવાનો પૂરતો સમય મળી રહે. રાજકીય પક્ષો માટે તેમની વેબસાઇટ પર પેનિંગ ફોજદારી કેસ ધરાવતા વ્યક્તિઓ વિશે વિગતવાર માહિતી અપલોડ કરવી ફરજિયાત છે. આ વિગતોમાં ગુનાના પ્રકાર તથા આરોપ ધડવામાં આવ્યા છે કે નહીં, સંબંધિત કોર્ટ, કેસ નંબર વગેરેનો સમાવેશ થવો જોઈએ. આ ઉપરાંત રાજકીય પક્ષોએ પણ આવા ઉમેદવારની પસંદગી માટેના

કારણો રજૂ કરવા પડશે. રાજકીય પક્ષોએ એની પણ સ્પષ્ટતા કરવી પડશે કે ગુનાઇત રેકોર્ડ વિનાની અન્ય વ્યક્તિઓને ઉમેદવાર તરીકે શા માટે પસંદ કરી શકાઈ નથી. ચૂંટણીપંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પસંદગી માટેના કારણો સંબંધિત ઉમેદવારની લાયકાત, સિદ્ધિઓ અને યોગ્યતાના સંદર્ભમાં હોવા જોઈએ અને તે માત્ર ચૂંટણીમાં “જીતવાની ક્ષમતા”ના સંદર્ભમાં હોવા જોઈએ નહીં. માર્ગદર્શિકા મુજબ આ વિગતો ઉમેદવારોના પ્રભુત્વાની પ્રથમ તારીખના બે અઠવાડિયા પહેલા નહીં, પરંતુ ઉમેદવારની પસંદગીના 48 કલાકની અંદર પ્રકાશિત કરવી પડશે. આ પછી સંબંધિત રાજકીય પક્ષે ઉમેદવારની પસંદગીના 72 કલાકની અંદર આ માહિતીના પાલનનો અહેવાલ ચૂંટણી પંચને સુપરત કરવાનો રહેશે.

ઉમેદવારના રોકડ ખર્ચની મર્યાદા ઘટાડવા ચૂંટણીપંચની દરખાસ્ત નવી દિલ્હી : ચૂંટણીપંચે ચૂંટણીપ્રચાર દરમિયાન ઉમેદવારના રોકડ ખર્ચની મર્યાદાને રૂ.10,00,000થી ઘટાડી રૂ.2,00,000 કરવાની દરખાસ્ત કરી છે. ઉમેદવારોના ટ્રાન્સપેરન્સીમાં પારદર્શિકતા લાવવા માટે આ દરખાસ્ત કરાઈ છે. તાજેતરમાં સરકારને સુપરત ક્લેલી દરખાસ્તમાં ચૂંટણીપંચે ભલામણ કરી છે કે ચૂંટણી નિયમોમાં સુધારો કરીને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ચૂંટણી સંબંધિત ખર્ચ માટે વ્યક્તિ અથવા સંસ્થાને કરવામાં આવતા તમામ કેશ પેમેન્ટ એકાઉન્ટ પે ચેક અથવા ઓનલાઇન મારફત થાય. હાલમાં ઉમેદવારોએ રૂ.10,00,000થી વધુના તમામ પેમેન્ટ માત્ર ચેક, ડ્રાફ્ટ અથવા બેંક ટ્રાન્સફર મારફત કરવા પડે છે.



રાહુલના હાથને પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર ચાવડાનો સાથ... કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત ખેડો યાત્રા પૂર્વેશમાં ચાલી રહી છે. તેમની સાથે નવા નેતાઓ ખેડોડાતા રહે છે. તેલંગાણાના મેદકમાં જોડેલા રાહુલની સાથે પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર ચાવડા પણ ખેડોડાતા હતા. એક સમયે રાહુલને તેમના ઘાટી સ્વર્ગીય ઇન્ડિયા ગાંધીની તસ્વીર ભેટમાં આપી હતી.

જો સરકાર ફરીથી બનશે તો અમે સમાન નાગરિક સંહિતા લાવીશું: ભાજપ
હિમાચલ પ્રદેશ માટેનો ઢેંટરો જાહેર: અનેક વચનોની લહાણી

એજન્સી > શિમલા

ભાજપે હિમાચલ પ્રદેશ માટે પોતાનો ચૂંટણી ઢેંટરો જાહેર કર્યા છે. તેણે વચન આપ્યું છે કે જો તે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતશે તો તેમાં સમાન નાગરિક સંહિતા (સીએએ) લાગુ કરવામાં આવશે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે, જેની ભલામણોના આધારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. આ સાથે ભાજપે પોતાના ઘોષણાપત્રમાં તમામ વર્ગોને આકર્ષવા માટે ઘણા વચનો આપ્યા છે. ભાજપે વચન આપ્યું છે કે જો ફરી સરકાર બનશે તો તે કિસાન સન્માન નિધિમાં વાર્ષિક 3000 રૂપિયાનો વધારો કરશે. 8 લાખથી વધુ રોજગારની તકો વધારશે. અમે તમામ ગામોને પાકા રસ્તાથી જોડીશું. શક્તિ નામની યોજના અમલમાં મૂકશે, જેમાં ધાર્મિક સ્થળોની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે 12000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સફરજનના પેકેજિંગ પર GST 12% રહેશે.

હિમાચલ ફક્ત દેવભૂમિ જ નહીં વીરભૂમિ પણ છે: અમિત શાહ ચૂંટણી સભામાં ગૃહમંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

એજન્સી > નગરોટા

હિમાચલપ્રદેશના નગરોટા વિધાનસભા મતવિસ્તારમાં જાહેરસભા સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસવાળાઓ પાસે એક જ મુદ્દો છે કે અહીંયા એક રિવાજ છે કે એક વાર કોંગ્રેસ આવે છે અને એક વાર ભાજપ. ઉત્તરાખંડ, યુપી, અસામ, મણિપુર જઈને જુઓ રિવાજ બદલી ગયો છે. હવે એક વાર ભાજપ આવે છે તો વારંવાર ભાજપ આવે છે. પાંચ વર્ષમાં હિમાચલના ધેર-ધેર ગેસ સિલેન્ડર પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી અને જયરામજી એ કર્યું. દરેક ઘમાં નલથી જળ પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે.



જવાન 40 વર્ષથી વનરેન્ડ વનપેન્શનની માંગ કરીરહ્યા હતા, પરંતુ કોંગ્રેસ સરકારે વન રેન્ડ વન પેન્શન આપ્યું નહીં. જ્યારે તમે 2014માં મોદીજીને વડાપ્રધાન બનાવ્યા, તો મોદીજીએ વન રેન્ડ વન પેન્શન લાગુ કરીને સૈન્યાના જવાનોનું સન્માન કર્યું. આ સાથે અમિત શાહે ઉમેર્યું કે આખે દેશ હિમાચલને દેવી-દેવતાઓની ભૂમિ દેવભૂમિના નામથી ઓળખે છે. પરંતુ હું હંમેશા કહેતો આવ્યો છું કે આ હિમાચલ ફક્ત દેવભૂમિ જ નહીં વીરભૂમિ પણ છે.

105ના રેકોર્ડ મતથી હરાવ પસાર: અનેક મુદાઓને આવી લેવાયા UNમાં ભારતે નાઝીવાદ અંગે રશિયાની તરફેણમાં મતદાન કર્યું

એજન્સી > વોશિંગ્ટન

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં “નાઝીવાદ” પર રશિયાના હરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. વ્યૂહાત્મક રીતે આ મતદાન કરીને ભારતે ઘણા સંદેશા આપ્યા છે. પાસ વાત એ છે કે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો હતો.



જાહેરાતમાં માર્શન્ટ્રસ, શરણાર્થીઓ, ઈસ્લામોફોબિયા, ઓફોફોબિયા અને યહૂદી વિરોધવાદને દેશનિકાલ કરવાની હકલ કરી હતી. જો કે, ઘણા દેશોએ કહ્યું હતું કે રશિયા યુકેન પરના તેના હુમલાને યોગ્ય ઠેરવવા માટે નિયો-નાઝીવાદનો આશરો લઈ રહ્યું છે. પોતાની ટિંચાઓનો પકડો પાડતા, યુનાઈટેડ કિંગડમના પ્રતિનિધિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ હરાવ જૂઠાણા અને વિકૃત ઇતિહાસને આગળ વધારીને યુકેન સામેના તેના આક્રમણને યોગ્ય ઠેરવવાના મોસ્કોના પ્રયાસનો એક ભાગ છે. યુનાઈટેડ સ્ટેટ્સના પ્રતિનિધિએ કહ્યું હતું કે રશિયા તેના ભૌગોલિક રાજકીય ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે બીજા વિશ્વ યુદ્ધથી ડરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિએ કહ્યું હતું કે મોસ્કો દ્વારા નાઝીવાદનો હથિયાર તરીકે ઉપયોગ અસ્વીકાર્ય છે.

સમજણથી જ અમે હરાવને અમારો ટેકો આપીએ છીએ.” આઠ ડ્રાફ્ટ હરાવોમાં માનવ અધિકાર, સાક્ષરતાનો અધિકાર અને જાતીય શોષણથી બાળકોની સુરક્ષાને લઈને અપરાધ નિવારણ તથા ફોજદારી ન્યાયની સાથે સાથે નાઝીવાદના મહિમામંડનનો સામનો કરવા માટેના ડ્રાફ્ટ હરાવને યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ત્રીજી સમિતિએ 105ના વિક્રમી મતથી મંજૂરી આપી હતી. 52 દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને 25 ગેરહાજર હતા. ભારતના પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું, “સ્વદેશી લોકોનો ખ્યાલ દેશના સંદર્ભમાં લાગુ પડતો નથી. આ

સુપ્રીમ કોર્ટે કર્મચારીઓને પેન્શન વૃદ્ધિની પસંદગીનો વિકલ્પ આપ્યો સભ્યોએ ચાર મહિનામાં નિર્ણય લેવાનો રહેશે

એજન્સી > નવી દિલ્હી

યોગદાનનો નિયમ હતો. સુપ્રીમ કોર્ટેના ચુકાદાને પગલે કર્મચારીઓ પેન્શન યોજનામાં વધુ યોગદાન આપી વધારાના લાભ મેળવી શકશે. વિવિધ ટ્રેડ યુનિયન્સે સુપ્રીમ કોર્ટેના આદેશનો તાત્કાલિક અમલ કરવા ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટીઓની અસામાન્ય બેઠક આપ્યા પછી આ શક્ય બન્યું છે. 1 સપ્ટેમ્બર, 2019ના રોજ એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ અથવા કર્મચારી પેન્શન યોજનાના સભ્ય વેતનનો ૮.૩૩ ટકા સુધીના હિસ્સાનું પેન્શનમાં યોગદાન આપી શકશે. અત્યાર સુધી પેન્શન માટે પેન્શનપાત્ર વેતનના ૮.૩૩ ટકાના યોગદાનમાં મહિને રૂ.૧૧,૦૦૦ના વેતનની ટોચમર્યાદા નિર્ધારિત કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2019ના કાયદાની જરૂરિયાતને રદ કરી હતી. જેમાં મહિને રૂ.૧૧,૦૦૦થી વધુ વેતન કરાઈ હતું. જેને થોડા સમય પછી ધરાવતા કર્મચારી માટે ૧.૧૬ ટકાના

પેન્શન યોજનામાં વધુ યોગદાન આપી વધારાના લાભ મેળવી શકશે. વિવિધ ટ્રેડ યુનિયન્સે સુપ્રીમ કોર્ટેના આદેશનો તાત્કાલિક અમલ કરવા ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટીઓની અસામાન્ય બેઠક આપ્યા પછી આ શક્ય બન્યું છે. 1 સપ્ટેમ્બર, 2019ના રોજ એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ અથવા કર્મચારી પેન્શન યોજનાના સભ્ય વેતનનો ૮.૩૩ ટકા સુધીના હિસ્સાનું પેન્શનમાં યોગદાન આપી શકશે. અત્યાર સુધી પેન્શન માટે પેન્શનપાત્ર વેતનના ૮.૩૩ ટકાના યોગદાનમાં મહિને રૂ.૧૧,૦૦૦ના વેતનની ટોચમર્યાદા નિર્ધારિત કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2019ના કાયદાની જરૂરિયાતને રદ કરી હતી. જેમાં મહિને રૂ.૧૧,૦૦૦થી વધુ વેતન કરાઈ હતું. જેને થોડા સમય પછી ધરાવતા કર્મચારી માટે ૧.૧૬ ટકાના

અલ્વીએ ઘાયલ ઈમરાનને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા પાક.માં ઈમરાન અને શાહબાઝ વચ્ચે મધ્યસ્થીની પ્રમુખ અલ્વીની ઓફર

એજન્સી > લાહોર

પાકિસ્તાનના પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ મુખ્ય મુદાઓ પર સર્વસંમતિ સાધવા માટે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) અને શાહબાઝ શરીફ સરકાર મધ્યસ્થી કરવાની ઓફર કરી છે, એમ રવિવારે મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું. આરિફ અલ્વી ગોળીથી ઈજાગ્રસ્ત થયેલા ઈમરાન ખાનને મળ્યા હતા અને તેમના આરોગ્ય અંગે પૂછપરછ કરી હતી. યુરુવારે પંજાબ પ્રાંતના વડીરાબાદ વિસ્તારમાં એક રેલી દરમિયાન થયેલા હુમલામાં ઈમરાન ખાનના જમણા પગમાં ગોળી વાગી હતી. આ મીડિંગ દરમિયાન અલ્વી અને ઈમરાન ખાને દેશની ગંભીર રાજકીય અને આર્થિક પરિસ્થિતિ અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.



પાનના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા લાહોરમાં શોકત ખાનમ મેમોરિયલ કેન્સર હોસ્પિટલ યુવાકાંટ લીધી હતી અને લગભગ ત્રણ કલાક તેમની સાથે રહ્યા હતા. પ્રેસિડન્ટ અને ફર્સ્ટ લેડીએ ઈમરાન ખાન ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભકામના આપી હતી. આ મીડિંગ દરમિયાન અલ્વી અને ઈમરાન ખાને દેશની ગંભીર રાજકીય અને આર્થિક પરિસ્થિતિ અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

ઈમરાન ખાન મંગળવારથી ફરી ફૂથ ચાલુ કરશે
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને રવિવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી મંગળવારથી ઈસ્લામાબાદ તરફની ફૂથ ફરી શરૂ કરશે. તેઓ પંજાબ પ્રાંતના એ જ સ્થળેથી સેલીનો પ્રારંભ કરશે કે જ્યાં તેમના પર હુમલો થયો હતો. શોકત ખાનમ હોસ્પિટલમાંથી પત્રકાર પરિષદને સંબોધતાં ઈમરાને જણાવ્યું હતું કે વડીરાબાદમાં જે સ્થળે મને અને અન્ય 11 લોકોને ગોળી વાગી હતી તે જ સ્થળેથી સેલી ફરી ચાલુ કરવાનો અમે નિર્ણય કર્યો છે. ઈમરાન ખાને તેમના પરના હુમલા માટે વડા પ્રધાન શાહબાઝ શરીફ અને અન્ય બે લોકોને જવાબદાર ગણાવ્યા હતા.

બેગર 8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન મોદીએ ₹ 500 અને ₹ 1000ની ચલણી નોટ પાછી ખેંચી હતી

નોટબંધીના છ વર્ષ પછી પાણ રોકડ છલોછલ ₹ 30.88 લાખ કરોડની નોટો બજારમાં પહોંચી

એજન્સી > મુંબઈ

નોટબંધીને છ વર્ષ થઈ ચૂક્યા છે અને આ ગાળામાં લોકો પાસેની રોકડનું પ્રમાણ રૂ.૩૦.૮૮ લાખ કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ૨૧ ઓક્ટોબરે જનતા પાસેની કરન્સી ૪ નવેમ્બર, 20૧૬ના રોજ પૂરા થયેલા પખવાડિયાની તુલનામાં ૭૧.૮૪ ટકા વધુ છે. તમામ ડેટા સૂચવે છે કે, નોટબંધીના છ વર્ષ પછી સિસ્ટમમાં રોકડનો વપરાશ ઘણો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ૮ નવેમ્બર, 20૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની ચલણી નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જેનો મુખ્ય હેતુ સિસ્ટમમાંથી કાઠું નાશુ અને ભ્રષ્ટાચાર ઘટાડવાનો હતો. વડાપ્રધાન મોદીના નિર્ણયની ઘણા નિષ્ણાતોએ યોજના અને યોગ્ય



અમલીકરણના અભાવ માટે ભારે ટીકા કરી હતી. જોકે, રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેર કરેલા ડેટા પ્રમાણે ૨૧ ઓક્ટોબરના રોજ લોકો પાસે રોકડનું પ્રમાણ વધીને રૂ.૩૦.૮૮ લાખ કરોડ થયું છે. રિઝર્વ મની અંગે રિઝર્વ બેન્કના આંકડા મુજબ ૪ નવેમ્બર, 20૧૬ના રોજ સિસ્ટમમાં કરન્સીનું પ્રમાણ રૂ.૧૭.૭ લાખ કરોડ હતું. જનતા પાસેની કરન્સી એટલે લોકો દ્વારા વ્યવહારમાં, વેપારના સેટલમેન્ટ વખતે અને માલસામાન કે સેવાની ખરીદીમાં વપરાતી ચલણી નોટો અને સિક્કા. લોકો

પાસેની કરન્સીમાંથી બેન્કોમાં રહેલી રોકડને બાદ કર્યા પછી સિસ્ટમમાં રહેલી રોકડનું પ્રમાણ ગણવામાં આવે છે. ભારતીય અર્થતંત્ર સતત વૃદ્ધિના માર્ગે છે. પેમેન્ટના ડિજિટલ વિકલ્પો પણ પ્રચલિત બન્યા છે. કોરોના મહામારીને કારણે પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને વેગ મળ્યો છે. તમામ પરિબળો વધારે વેગે રોકડના પ્રમાણમાં છતાં નોંધાયો છે. રિઝર્વ બેન્કે 20૧૯માં ડિજિટલ પેમેન્ટ અંગેના અભ્યાસમાં જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ મૂલ્ય અને વોલ્યુમની રીતે વધી રહ્યું છે. જોકે, ડેટા એવું પણ સૂચવે છે કે અર્થતંત્રની વૃદ્ધિ સાથે જીડીપીના પ્રમાણમાં લોકો પાસેની રોકડ પણ વધી છે.” અભ્યાસમાં જણાવ્યું હતું કે, “નોટબંધી પછી ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ મોટા પાયે વધ્યા

છે. જોકે, જીડીપી રેશિયોના પ્રમાણમાં ડિજિટલ પેમેન્ટ્સ પરંપરાગત રીતે નીચું રહ્યું છે.” ઉલ્લેખનીય છે કે, નોટબંધીના અમલ પછી ડિજિટલ પેમેન્ટને ઝડપથી વેગ મળવાનો અંદાજ હતો. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ સહિતના ડિજિટલ પેમેન્ટ સામેલ હતા. જોકે, કોરોના પછી ડિજિટલ પેમેન્ટના માધ્યમોનો ઉપયોગ અચાક વધી ગયો છે. જેમાં યુપીઆઇ સહિતના પેમેન્ટ વિકલ્પોનું યોગદાન ઘણું મોટું છે. SBIના અર્થશાસ્ત્રીઓએ તાજેતરની નોંધમાં જણાવ્યું હતું કે, “દિવાળીના સપ્તાહમાં સક્ર્યવેશનમાં રહેલી કરન્સીનું પ્રમાણ રૂ.૭,૬૦૦ કરોડ થયું હતું. 20૦૯ના તહેવારોની ગણતરી ન કરીએ તો, લગભગ બે દાયકામાં આવું પહેલી વખત બન્યું. 20૦૯માં વૈશ્વિક નાણાકીય ક્રીકડટીને કારણે રોકડના પ્રમાણમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો.

Rajoo Engineers Limited

Regd. Office: Survey No 210, Plot No 1, Industrial Area, Veraval (Shapar), Dist. Rajkot-360024 Phone: +91-97129-62704 / 527011/32706, Email: compliances@rajoo.com, Web: www.rajoo.com CIN: L27100GJ1986PLC009212

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2022

Sr. No.	Particulars	Quarter Ended (Un-Audited)		Period Ended (Un-Audited)		Year Ended (Audited)
		30.09.2022	30.06.2022	30.09.2021	30.09.2021	
1	Total Income	3407.06	1928.18	3737.50	5335.24	17498.59
2	Net Profit Before Tax*	310.54	100.29	463.86	410.83	1899.57
3	Net Profit After Tax*	232.38	75.05	334.71	307.43	1479.71
4	Total Comprehensive Income for the period [Comprising Profit / Loss for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	232.38	75.05	334.71	307.43	1517.57
5	Paid up Equity Share Capital (Face Value of Re.1 Each)	615.31	615.31	615.31	615.31	615.31
6	Reserve (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year)	0.00	0.00	0.00	0.00	8765.93
7	Earnings per share (before and after extraordinary items) (Face Value of Re.1/Share)	0.38	0.12	0.54	0.50	2.40
	(a) Basic	0.38	0.12	0.54	0.50	2.40
	(b) Diluted	0.38	0.12	0.54	0.50	2.40

Note : * There was no exceptional / extraordinary item during the Quarter and half year ended on September 30, 2022

The above un-audited financial results for the quarter and half year ended on September 30, 2022 have been reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors of the Company in its meeting held on November 05, 2022. The Statutory Auditors of the Company have carried out limited review of the financial results for the quarter and half year ended on September 30, 2022. Their limited review report does not have any qualification/modification.

The above is an extract of the detailed format of quarterly and half yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarterly/half yearly/yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the company's website (www.rajoo.com)

For & on behalf of Board of Directors of Rajoo Engineers Limited
Sd/-
Khushboo Chandrakant Doshi
(Managing Director)
(DIN: 00025581)

Place: Veraval (Shapar)
Date: 07/11/2022

Performance Highlights

- Revenue from operations for the quarter was Rs. 33.63 crore in Q2 FY23, as against Rs. 18.21 crore in Q1 FY23, a QoQ increase of 84.65%
- EBITDA (excluding Other Income) was at Rs. 3.60 crore in Q2 FY23 as against Rs. 0.82 crore in Q1 FY23, increase of 338.34% QoQ.
- EBITDA Margin was at 10.69% as against 4.50%, QoQ increase of 619 bps
- Profit after Tax was Rs. 2.32 crore in Q2 FY23 compared to Rs. 0.75 crore in Q1 FY23, QoQ increase of 209.64%
- PAT Margin was at 6.91% as against 4.12%, QoQ increase of 279 bps.
- Basic EPS stood at Rs. 0.38 in Q2 FY23 as compared to Rs. 0.12 in Q1 FY23

About Rajoo

Based in Rajkot, Rajoo Engineers Limited, having made a modest beginning in 1986, has today emerged as an undisputed global player in blown film and sheet extrusion lines. Owing to its focused efforts in blown film, sheet extrusion lines and thermoformers, the Company enjoys a premium market position in this segment. Being a technology driven Company, product innovations, world-class quality, state-of-the-art workmanship, increased energy efficiency and high levels of sophistication and automation have become the hallmark of Rajoo products during all these years, positioning the Company's products on a global platform, competing with the established world leaders. With representations in many countries of the world and customers in over 70 countries, the Company's exports have multiplied after its debut in the international market in 1990. (www.rajoo.com)

The Indian Wood Products Company Ltd.
 Regd. Off: 7th Floor, 9 Brabourne Road,
 Kolkata - 700 001
 CIN L20191WB1919PLC003557
 Tel: 8232029820, Fax: 033 22426799
 Website: www.iwppkatha.com
 E-mail: iwpho@iwppkatha.co.in

NOTICE is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Monday, November 14, 2022, at 11.00 A.M. at 16B, Judges Court Road, Kolkata - 700 027, West Bengal. To consider and approve, inter alia, the Un-Audited Financial Results of the Company for the Quarter and Half Year ended September 30, 2022.

The said Notice may be accessed on the Company's Website at <http://www.iwppkatha.com> and may also be accessed on the Stock Exchange website at <https://www.bseindia.com>

For The Indian Wood Products Co. Ltd.
 Place: Kolkata
 Date: 05.11.2022
 Anup Gupta
 Company Secretary

NATIONAL SEEDS CORPORATION LTD.
 (A Govt. of India Undertaking - Mini Ratna Company)
 CIN No. U74899DL1963GOI003913
 RO - Block-AQ, Plot -12, Sector-5, Salt Lake, Kolkata-700 091
 Ph. 033-2367-1077 / 74.
 E-mail : nsc.kolkata.ro@gmail.com
 No.- Engg-8(BBSR-TCL-EOP)/NSC-KOL/2022-23 Dated: 04-11-2022

NOTICE
 E - Tender for Minor Modifications in extended Tissue Culture Lab at NSC, Bhubaneswar

For details, please visit NSC's website www.indiaseeds.com under Public Notice (Tender/Quotations). Online Bids for above tender must be submitted at NSC e-Portal: <https://indiaseeds.envida.com> latest by 14:30 Hrs. of 25-11-2022. Corrigendum / addendum, if any, shall only be published in NSC's website.

Regional Manager
 NSC, Kolkata

TORRENT PHARMACEUTICALS LIMITED
 Registered Office : Torrent House, Off Ashram Road, Ahmedabad - 380 009 Gujarat, India
 Ph: 91 79 26599000
 Fax: + 91 79 26582100
 CIN: L24230GJ1972PLC002126
 Website: www.torrentpharma.com
 Email Id: investorservices@torrentpharma.com

PUBLIC NOTICE

Notice is hereby given that the original share certificates, details of which are given hereunder, have been reported lost / misplaced:

Sr. No.	Folio No.	Name Of the Share Holders	No of Shares	Certificate No.	Distinctive Nos (From)	Distinctive Nos (To)
1	TRE0046704	Ghanshyam Talwar Suneta Talwar	200	3285	534847	535046
			200	6659	42840527	42840726
			400	7308	84721661	84722060

Pursuant to request received from concerned shareholder, the Company intends to issue duplicate share certificates in lieu of the aforesaid original share certificates. Public is cautioned against purchasing or otherwise dealing with the above mentioned share certificates. Duplicate share certificates thereof will be issued to the above named shareholder, unless any objection is received by the undersigned within 10 days from the date of publication of this notice.

For TORRENT PHARMACEUTICALS LIMITED
 CHINTAN N TRIVEDI
 COMPANY SECRETARY
 Place : Ahmedabad
 Date : 05th November, 2022

Kirloskar Ferrous Industries Limited
 A Kirloskar Group Company
Registered Office: 13, Laxmanrao Kirloskar Road, Khandki, Pune - 411 003, (Maharashtra)
 CIN: L27101PN1991PLC063223



Statement of Unaudited Financial Results for the quarter and six months ended 30 September 2022

(Figures are ₹ in Crores unless stated otherwise)

Sr. No.	Particulars	Standalone						Consolidated					
		Quarter ended		Period ended		Year ended	Quarter ended		Period ended		Year ended		
		30/09/2022	30/06/2022	30/09/2021	30/09/2021		31/03/2022	30/09/2022	30/06/2022	30/09/2022		31/03/2022	
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Audited			
1	Total Income from Operations	1133.47	949.88	958.38	2,083.35	1,781.21	3,614.97	1,757.54	1,493.82	3,251.36	3,748.29		
2	Net Profit for the period (before Tax and Exceptional Items)	114.05	109.23	160.58	223.28	346.93	542.69	153.98	125.61	279.59	533.19		
3	Net Profit for the period before Tax (after Exceptional Items)	114.05	109.23	160.58	223.28	346.93	542.69	153.98	125.61	279.59	533.19		
4	Net Profit for the period after Tax (after Exceptional Items)	82.00	83.85	119.91	165.85	259.41	406.10	110.99	102.08	213.07	299.72		
5	Total Comprehensive Income for the period (comprising Profit (after tax) and Other Comprehensive Income (after tax) for the period)	81.36	84.79	120.08	166.14	259.37	409.51	111.59	101.54	213.13	791.34		
6	Paid up Equity Share Capital (Face Value of ₹ 5 each)	69.41	69.37	69.21	69.41	69.21	69.36	69.41	69.37	69.41	69.36		
7	Reserves (excluding Revaluation Reserve)	1,396.11	1,353.27	1,148.68	1,396.11	1,148.68	1,266.71	1,851.59	1,791.49	1,851.59	1,695.97		
8	Securities Premium Account	206.50	205.86	205.65	206.50	203.20	205.65	206.50	205.86	206.50	205.65		
9	Net Worth	1,465.57	1,423.02	1,465.57	1,465.57	1,465.57	1,465.57	2,812.22	2,739.53	2,812.22	2,635.98		
10	Paid up Debt Capital	250.00	250.00	0.00	250.00	0.00	250.00	250.00	250.00	250.00	250.00		
11	Debt-Equity Ratio	0.70	0.75	0.17	0.70	0.17	0.85	0.37	0.39	0.37	0.43		
12	Earnings Per Share (₹) (not annualised)												
	(a) Basic	5.91	6.04	8.66	11.95	18.74	29.32	6.97	6.74	13.71	25.06		
	(b) Diluted	5.89	6.03	8.62	11.92	18.66	29.23	6.94	6.73	13.67	24.99		
13	Capital Redemption Reserve	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA		
14	Debture Redemption Reserve	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA	NA		
15	Debt Service Coverage Ratio	3.36	3.52	9.00	3.32	9.55	6.83	4.24	4.19	4.08	6.67		
16	Interest Service Coverage Ratio	6.64	6.67	32.80	6.65	34.39	20.48	7.26	7.15	7.21	19.03		

The above is an extract of detailed format of annual financial results filed with the BSE Limited pursuant to Regulations 33 and 52 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of annual financial results alongwith notes thereto are available on the website of the BSE Limited at www.bseindia.com and the website of the Company at www.kirloskarferrous.com

For Kirloskar Ferrous Industries Limited
 Place: Pune
 Date: 5 November 2022
 R. V. Gurnasthi
 Managing Director (DIN: 00082929)

Telephone No: +91 (020) 6084645 - Fax No: +91 (020) 25813208
 E-mail: stf@investor.kirloskar.com - Website: www.kirloskarferrous.com

Mark bearing word "Kirloskar" in any form as a suffix or prefix is owned by "Kirloskar Proprietary Limited" and "Kirloskar Ferrous Industries Limited" is the Permitted User.

EARUM PHARMACEUTICALS LIMITED
 CIN: L24230GJ2012PLC071299
 Registered Office: G1, Ground Floor, V R Complex, Near Sanathal Cross Road, SP Ring Road, Sanathal, Ahmedabad-382210 • Phone: 079 - 48402525
 Email: cs@earumpharma.com | Website: www.earumpharma.com

Statement of Unaudited financial results for the quarter and half year ended 30/09/2022

(Rs. In Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter Ending on 30.09.2022	Year to Date Figures 31.03.2022	Corresponding Three Months Ended in the Previous Year 30.09.2021
1	Total income from operations (net)	711.44	2,873.86	1062.33
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	3.67	308.17	539.97
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	3.67	308.17	539.97
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3.67	222.41	539.97
5	Total Comprehensive income for the period (after Tax)	3.67	222.41	539.97
6	Equity Share Capital	1233.58	1233.58	1233.58
7	Other Equity	0.00	438.94	0.00
8	Face Value of Equity Share Capital	2.00	2.00	2.00
9	Earnings Per Share (Basic / Diluted)	0.003	0.36	4.38

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and Company website i.e. www.earumpharma.com

For, Earum Pharmaceutical Limited
 SD/-
 Bhumishri Patel
 Director
 DIN: 02516641
 Date: 05/11/2022
 Place: Ahmedabad

IDBI BANK
 બંધા, મહામુખુ ની બેંક સામે, વિજ્યા બેંક પાછળ, પોર્ટલેન્ડ - ૩૭૦૫૫૫.

APPENDIX IV (RULE 8(1))
કંપની નોટીસ (અચલિત મિલકત માટે)

નીચે સહી કરનાર આઈડીબીઆઈ બેંક લિમિટેડના અધિકૃત અધિકારીએ સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રીફરેન્ડેન્સિયલ એન્ડ ફાઇનાન્સિયલ એન્ડ એન્ડોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ડ), ૨૦૦૨ (૨૦૦૨નો ૫૪) અને સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ડ) નિયમો, ૨૦૦૨ (૩૯) ના નિયમ ૧૩(૧૨) સાથે વંચાતી કલમ ૩ અન્વયે પ્રાપ્ત અધિકારીની રૂએ તા. ૦૧.૦૪.૨૦૨૧ના રોજ જારી કરેલ ડિમાન્ડ નોટિસ દ્વારા કરજદાર (૧) શ્રી ભીષ્મ ટેલર મોટીવાસ (૨) શ્રીમતી પ્રેમિલેન મોટીવાસને નોટિસમાં જણાવેલ રકમ રૂ. ૨૦,૦૮,૪૩૧/- (રૂપિયા વીસ લાખ આઠ હજાર ચારસો એકત્રીસ પૂરા) તા. ૩૧.૦૩.૨૦૧૯ થી ચકત વ્યાજ સાથે સરદર નોટિસ મળ્યા તારીખથી ૬૦ દિવસમાં ચૂકવવા જણાવવામાં આવ્યું હતું. કરજદાર આ રકમ ચૂકવવામાં અસક્ત રહ્યા હતા જેથી કરજદાર અને જાહેર જનતાને નોટિસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનાર જણાવેલ કાચદાની કલમ ૧૩(૪) સાથે સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ડ) રૂલ્સ, ૨૦૦૨ ના વંચાતા નિયમ ૮ હેઠળ મળેલ સત્તાની રૂએ તા. ૦૧.૧૧.૨૦૨૨ના રોજ નીચે જણાવેલ મિલકતનો કબજો લીધેલ છે. આ નોટિસ દ્વારા કરજદારને વિશેષ રીતે જાહેર જનતાને સામાન્ય રીતે સુચિત કરવામાં આવે છે કે નીચે દર્શાવેલ મિલકતનો સોદો કરવો નહીં કોઈપણ મિલકતનો સોદો કરવો તો તે આઈડીબીઆઈ બેંક લિમિટેડના બાકી રૂ. ૨૦,૦૮,૪૩૧/- (રૂપિયા વીસ લાખ આઠ હજાર ચારસો એકત્રીસ પૂરા) અને ભવિષ્યનું વ્યાજ સાથેની રકમના બોજા આધિન રહેશે.

ગીરવે રાખેલ અરકમમાંનો આવેલા સમયાં છોડાવવા અંગે કરજદારનું કાચદા સેક્શન ૧૩ ના સબ-સેક્શન (૮) ની જોગવાઈ તરફ ધ્યાન દોરવામાં આવે છે.

મિલકતોનું વર્ણન

૧૫૦૨ નં. ૫૫ નો એક ભાગ, શ્રી નારાયણ નગર, રેલેયુ સર્વે નં. ૩૨ ૨ ૨, દક્ષિણ બાજુ ભવાની ઈન્ડસ્ટ્રીઝ, પોર્ટલેન્ડ, ગુજરાત - ૩૭૦૫૫૫. તાલુકા રજુવેશન સમ-જી૫૦ પોર્ટલેન્ડ જી૫૦ ની ગેરો એન્ડેસ જમીનના બધા ભાગ અને દિસ્વા સાથે, ચતુરસ્રીના આ મુજબ છે: પૂર્વભાગ: પ્લોટ નં. ૩૯, પશ્ચિમભાગ: ૫.૫૦ મીટર પહોળો રોડ, દક્ષિણભાગ: પ્લોટ નં. ૫૪, ઉત્તરભાગ: પ્લોટ નં. ૫૪ તેની સાથે ત્યાં આવેલ બધા રક્ષક અને વિદ્યુતિ અને બધા પ્લાન્ડ અને મશીની જે જમીન સાથે રચાયેલી છે અને જમીન સાથે કાચની જોડાવેલ દરેક વસ્તુ.

સ્થળ : પોર્ટલેન્ડ
 તારીખ : ૦૧.૧૧.૨૦૨૨
 અધિકૃત અધિકારી
 આઈડીબીઆઈ બેંક (પોર્ટલેન્ડ શાખા)

IDBI BANK
 જલુતી સર્કલ, બસ સ્ટેશન રોડ, ભુજ પીન - ૩૭૦૦૦૧, ગુજરાત

APPENDIX IV (RULE 8(1))
કંપની નોટીસ (અચલિત મિલકત માટે)

નીચે સહી કરનાર આઈડીબીઆઈ બેંક લિમિટેડના અધિકૃત અધિકારીએ સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રીફરેન્ડેન્સિયલ એન્ડ ફાઇનાન્સિયલ એન્ડ એન્ડોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ડ), ૨૦૦૨ (૨૦૦૨નો ૫૪) અને સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ડ) નિયમો, ૨૦૦૨ (૩૯) ના નિયમ ૧૩(૧૨) સાથે વંચાતી કલમ ૩ અન્વયે પ્રાપ્ત અધિકારીની રૂએ તા. ૦૬.૦૬.૨૦૨૧ના રોજ જારી કરેલ ડિમાન્ડ નોટિસ દ્વારા કરજદાર (૧) શ્રી નિમેષ મહેષા જેઠી (કરજદાર) (૨) શ્રીમતી આશા મહેષાવર્ધ જેઠી (સહ-કરજદાર) ને નોટિસમાં જણાવેલ રકમ રૂ. ૨,૧૬,૧૨,૫૦૭/- (રૂપિયા બે કરોડ એગ્રાહીસ લાખ બાર હજાર પાંચસો સાત પૂરા) તા. ૩૧.૦૩.૨૦૨૧ થી ચકત વ્યાજ સાથે સરદર નોટિસ મળ્યા તારીખથી ૬૦ દિવસમાં ચૂકવવા જણાવવામાં આવ્યું હતું. કરજદાર આ રકમ ચૂકવવામાં અસક્ત રહ્યા હતા જેથી કરજદાર અને જાહેર જનતાને નોટિસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનાર જણાવેલ કાચદાની કલમ ૧૩(૪) સાથે સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ડ) રૂલ્સ, ૨૦૦૨ ના વંચાતા નિયમ ૮ હેઠળ મળેલ સત્તાની રૂએ તા. ૦૩.૧૧.૨૦૨૨ના રોજ નીચે જણાવેલ મિલકતનો સંક્રમિત કબજો લીધેલ છે. આ નોટિસ દ્વારા કરજદારને વિશેષ રીતે જાહેર જનતાને સામાન્ય રીતે સુચિત કરવામાં આવે છે કે નીચે દર્શાવેલ મિલકતનો સોદો કરવો નહીં કોઈપણ મિલકતનો સોદો કરવો તો તે આઈડીબીઆઈ બેંક લિમિટેડના બાકી રૂ. ૨,૧૬,૧૨,૫૦૭/- (રૂપિયા બે કરોડ એગ્રાહીસ લાખ બાર હજાર પાંચસો સાત પૂરા) અને ભવિષ્યનું વ્યાજ સાથેની રકમના બોજા આધિન રહેશે.

ગીરવે રાખેલ અરકમમાંનો આવેલા સમયાં છોડાવવા અંગે કરજદારનું કાચદા સેક્શન ૧૩ ના સબ-સેક્શન (૮) ની જોગવાઈ તરફ ધ્યાન દોરવામાં આવે છે.

મિલકતોનું વર્ણન

કુલ નં. બી-૩ ઓ. ૩ ગ્રીડ, અંક ૬૧, સોલમ ડોમેસ્ટ, સોનીની ચાલી ચાર રસ્તા બંધ, ઓલેવ, અમદાવાદ-૩૮૨૧૧૫ ફોન : ૦૭૯-૨૨૮૨૨૨૦, ઈ-મેલ : bagunagar@idbibanbank.co.in

(સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ડ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૧) હેઠળ)
કંપની નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી નીચે સહી કરનાર ઈન્ડિયન બેંકના અધિકૃત અધિકારીએ સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રીફરેન્ડેન્સિયલ એન્ડ ફાઇનાન્સિયલ એન્ડ એન્ડોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ડ) ૨૦૦૨ હેઠળ અને સિક્યોરિટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ડ) રૂલ્સ, ૨૦૦૨ના (નિયમ ૩ સાથે વંચાતી) કલમ ૧૩ (૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ તા. ૧૯.૦૫.૨૦૨૨ ના રોજ મોગાના નોટિસ જારી કરી દેવાદાર નં. સરીના એન્ડેસાર્થ (મોપ્રાચરશીપ પેટી, દેવાદાર), શ્રી સુમીટ્રી જી. ચોખ (મોપ્રાચર અને જમીનદાર), શ્રીમતી સરીના એમ. ચોખ (જમીનદાર) અને શ્રી ચીમુદિયન કુલુદીન ચોખ (જમીનદાર અને ગીરવેદાર) ને નોટિસમાં જણાવેલ તા. ૧૯.૦૫.૨૦૨૨ મુજબની રકમ રૂ. ૩૨,૦૬,૪૬૬.૫૦ (રૂપિયા ત્રીસ લાખ છ હજાર ચારસો છાસ અને પચાસ પેસા પૂરા) જણાવેલ નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચૂકવવા જણાવ્યું હતું. દેવાદારો/જમીનદારો/ગીરવેદાર આ રકમ પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદારો/જમીનદારો/ગીરવેદાર અને જાહેર જનતાને આ નોટિસથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે સદરહુ રૂલ્સના નિયમ ૮ સાથે વંચાતી સદરહુ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત થયેલી સત્તાની રૂએ નીચે દર્શાવેલી મિલકતનો ૦૪ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ કબજો લીધેલો છે.

ખાસ કરીને દેવાદારો/જમીનદારો/ગીરવેદાર અને જાહેર જનતાને આથી મિલકત સાથે સોદો ન કરવા સાથે કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઈપણ સોદો ઈન્ડિયન બેંક, ભુવનગર શાખાની તા. ૧૯.૦૫.૨૦૨૨ મુજબની રકમ રૂ. ૩૨,૦૬,૪૬૬.૫૦ (રૂપિયા ત્રીસ લાખ છ હજાર ચારસો છાસ અને પચાસ પેસા પૂરા) અને તેના પરના ભવિષ્યના વ્યાજ અને ખર્ચના સાંચને આધિન રહેશે.

સદરહુ કાચદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ તરફ કરજદારનું મુકર મિલકત છોડાવવા માટે માળખાકરમ સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતની વિગત

શ્રી ચોખ ગુલામ મયુદીન કુલુદીનના નામે ગુજરાત રાજ્યમાં મોજે ગામ મકતમપુરા, તાલુકા અને જિલ્લા અમદાવાદ (પાલડી-૪) ના સર્વે નં. ૧૪, દિસ્વા નં. ૧૪૩ પર સનરાઈઝ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ દ્વારા જળવાયેલ સનરાઈઝ એપાર્ટમેન્ટના વ્લોક નં. એ નાથા મોળે ૩૯.૯૨ ચો.મી. એવેલે કે વ્લોક વાર (સુવર ગિલ્ટ એપ) માંના ૩૯.૯૨ ચો.મી. એ/૧૬ તરીકેની સ્થાવર મિલકતના તે તમામ પીસ અને પાર્સલ. મિલકતની ચલુસીમાં : ઉત્તર : ૩૯.૯૨ ચો.મી. એ/૧૫, દક્ષિણ : વ્લોક નં. બી, પૂર્વ : સોસાયટીનો રોડ, પશ્ચિમ : પેલેચ.

સ્થળ : ભુજ
 તારીખ : ૦૩.૧૧.૨૦૨૨
 અધિકૃત અધિકારી
 આઈડીબીઆઈ બેંક (રાજકોટ)

NEL Holdings South Limited
 Regd. Office: No. 110, Level 1, Andrews Building, M.G.Road, Bangalore KA 560 001 IN
 CIN: L9300KA2004PLC033412
 Email: investor@nelholdings.in | Phone: +91 80 2227 2220
 Website: www.nelholdings.in

Statement of Consolidated unaudited financial results for quarter and six months ended September 30, 2022

(Rs. in Lakh) except EPS data

Sl. No.	Particulars	Quarter ended			Period ended			Previous year ended 31-03-2022
		3 months ended 30-09-2022	Preceding 3 months ended 30-06-2022	Corresponding 3 months ended 30-09-2021	Year to date figures for current period ended 30-09-2022	Year to date figures for current period ended 30-09-2021		
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited		
		Audited	Audited	Audited	Audited	Audited		
1	Total Income from operations	915	969	4,037	1,884	5,551	9,430	
2	Net (Loss)/profit for the period (before tax and exceptional items)	(10,869)	(3,134)	18,333	(14,004)	16,043	8,418	
3	Net (Loss)/profit for the period before tax (after exceptional items)	(10,869)	(3,134)	18,333	(14,004)	16,043	8,418	
4	Net (Loss)/profit for the period after tax (after exceptional items)	(10,905)	(3,172)	56	(14,078)	26,769	(6,530)	
5	Total Comprehensive (Loss)/Income for the period (Comprising (loss) /profit after tax and Other Comprehensive (loss)/Income after tax)	(10,884)	(3,151)	11	(14,036)	26,702	(6,608)	
6	Equity Share Capital	14,583	14,583	14,583	14,583	14,583	14,583	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	-	
8								